

## Preparing for stormy weather

Government preparedness and improved warning systems are still not adequate to prevent the loss of property and lives from cyclones



## Answers needed: SC reprimands Centre's jab policy

Reader's Speak: Rising price of onions and other vegetables



Sir—The Supreme Court has rightly reprimanded the Centre for its policy of giving free vaccination to people above 45 years of age and having a paid system for the rest, calling it "prima facie arbitrary and irrational" ("Bunglers", June 7). Flagging several other problems, the court has asked the Centre to review its vaccination policy. Bringing up the issue of differential pricing, the apex court directed the Centre to submit a comparison of the prices of vaccines available in India to their international prices.

In most countries, vaccines are procured by the governments and distributed to the people free of cost while in India, people aged between 18-44 are paying record prices for vaccines. The court has asked for dates of the procurement orders of all vaccines—Covishield, Covaxin and Sputnik V—the number of doses ordered and the projected date of supply. Under the current vaccine policy, states can buy up to 50 per cent of their vaccine requirements from manufacturers but are paying a much higher price than the Centre. The private hospitals are being charged even more. The discrepancy has led to many demanding an even vaccination policy. The Centre must reveal its reasons for refusing to implement a universal free vaccination programme in spite of setting aside a substantial amount for the purpose. Sir—The differential pricing of vaccine doses adopted by the Centre is unfair. It is also morally wrong to burden the cash-strapped state governments even further by forcing them to procure coronavirus vaccines at a higher price. Thus, the directive of the Supreme Court asking the Centre to re-evaluate its vaccine policy is welcome. The government must prioritize the well-being of the people and vaccinate all citizens free of cost. By furnishing the details of the expenditure from the Rs 35,000 crore earmarked in the Union budget for the procurement of vaccines as directed by the top court, the government can validate its claim that it has nothing to hide. The government should also review the mandatory registration on the CoWIN app for booking slots for jabs and put in place more viable options to avoid exclusion. We expect and hope that the government will abide by the wisdom of the Supreme Court. Sir—With regional lockdowns being imposed across India, supply chains have been immensely disrupted. The price of onions and other vegetables that are grown in other parts of the country have been steadily rising in Bengal. The increase has been attributed to the delay in transportation as well as a hike in diesel prices. There is an immediate need for the government to regulate the prices of basic food items. If food prices continue to increase, many would be left with no choice but to starve.

Gujarat recently experienced the most powerful cyclonic storm after 1998. Cyclone Tauktae caused widespread destruction of private and public assets, uprooting electricity poles and trees, damaging agricultural crops and houses, in addition to causing human fatalities. RMSI, a consultancy firm working in the catastrophe risk management area, has estimated the damage to be worth around Rs 7,500 crore in Gujarat and Daman & Diu. The figure is four times higher than the cost incurred during the 1998 cyclone. Tauktae inflicted similar damages in Kerala, Karnataka, Goa, and Maharashtra. According to the preliminary reports, the highest fatalities occurred in Gujarat (53) followed by Maharashtra (16), Karnataka (8) and Goa (3).

India's geo-climatic conditions, coastal erosion, and socio-economic vulnerabilities are responsible for the rise in the frequency of cyclones and the damages they are causing across India's coastal states. Around 75.83 per cent of the country's total coastline is exposed to cyclones and tsunamis, and 14.2 per cent of the population in 66 coastal districts in 13 coastal states/Union territories is vulnerable to the fury of cyclones. An earlier report published by the World Bank and the United Nations estimated that around 200 million residents would be exposed to storms and earthquakes by 2050 in India. According to a report by the Odisha government titled "Memorandum: Extremely Severe Cyclonic Storm 'Fani'", 2019, around 7 per cent of the world's cyclones originate in the Bay of Bengal and the Arabian Sea, with their impact being relatively higher when they make landfall in the area of North Bay of Bengal. The report also confirms that India experienced a total of 359 cyclones over the period, 1891-2000. Around 98 cyclones made landfall in Odisha's coastal zone which is the highest landfall experienced by states. Odisha was followed by Andhra Pradesh (79), West Bengal (69), Tamil Nadu (62), Gujarat (28), Maharashtra and Goa (18), Kerala (3) and Karnataka (2). In 2019, India was ranked the seventh most vulnerable country globally in the overall Global Climate Risk Index. Worryingly, India also ranked first in terms of deaths and economic losses due to extreme weather-related events. India lost 2,267 human lives and incurred damages worth US \$68,812 million in PPP terms in 2019. Among all the natural disasters occurring in India, cyclones are the second-most

frequent and lethal after floods. According to the ministry of earth science, out of every five cyclones developing over the Bay of Bengal and the Arabian Sea, three or four make landfall on the Indian coast, causing enormous destruction to life and property. Between 1999 and 2020, India experienced 37 cyclones, which saw 12,510 humans losing their lives and 73 million being adversely affected. The damages to public infrastructure and private property stood at around US \$3,111 million (EM-DAT). The frequency of cyclones increases the financial pressure on the government on account of expenditures incurred by way of rehabilitation and mitigation. During this period, India lost around 1.8 per cent of its gross domestic product and 1.2 per cent of Central government revenue to cyclones. Over the years, human fatality has declined significantly due to the upgradation of early warning systems and the construction of flood and cyclone shelters in low-lying areas. Evacuation measures along with effective disaster mitigation have helped minimize loss of lives. Additionally, there is better coordination between the Centre and the states; social

media also plays a critical role in spreading awareness about the impact of cyclones. However, government preparedness and improved warning systems are still not adequate to prevent the loss of property and lives. The government has adopted a long-term disaster management policy, which is aimed at improving warning systems, constructing cyclone shelters, linking roads connected to cyclone shelters, building or renovating saline embankments, and providing pucca houses to eligible beneficiaries, especially those living in vulnerable coastal areas. Enhanced coverage of shelter-belt plantation and the regeneration of mangroves have, to some extent, diminished the impact of cyclones. The government must adopt a zero-fatality approach to minimize damages from cyclones by modernizing disaster management mechanisms and making greater investments in cyclone risk mitigation infrastructure. Finally, a larger number of coastal districts should be brought under the National Cyclone Risk Mitigation Project, a flagship programme of the Government of India on cyclone risk mitigation.

## The four dimensions that will shape Quad

Three months after its virtual summit on March 12, the Quad—composed of the United States, India, Japan and Australia—is attaining greater consolidation, even as its challenges acquire a sharper edge. The coalescing of four maritime democracies in the Indo-Pacific to address the China challenge compels global attention. Quad has begun planning for its first person summit, to be held in Washington. The goal is to strengthen 'The Spirit of the Quad' (the title of the summit's joint statement) through expansion of partnership in vaccines, climate and critical technologies. Cooperation for infrastructure development, supply chain resilience and maritime security are also emerging as priorities. In this context, Quad's four dimensions merit a close look.

First, India-US ties have received a boost during

external affairs minister S Jaishankar's substantive discussions in Washington in late May. His interactions with key figures of the administration, Congress and corporate America focused attention on advancing cooperation in the fight against Covid, fine-tuning the strategy to deal with China, and deepening of bilateral security, defence and economic relations. His informal meeting with Director of National Intelligence, Avril Haines, underlined the vital significance of intelligence-related cooperation in countering terrorism, the dynamic in Afghanistan after US troop withdrawal, and China's aggressive postures in eastern Ladakh and the Indian Ocean. These consultations have resulted in a closer convergence, which is good for Quad. Second, the geopolitical matrix has assumed special significance. Leading European countries—France, Germany, United Kingdom and the Netherlands—have been working on their Indo-Pacific policies. This was followed by the European Union (EU) announcing its Indo-Pacific strategy in April. EU is set to reinforce its strategic focus, presence and action in the region, based on the promotion of democracy, rule of law, human rights and freedom of navigation.

However, EU made it clear that its Indo-Pacific strategy was 'not anti-China.' India helped its own case with the historic India-EU Summit (on May 8), aiming to expand its relationship with an important global player. Third, the ASEAN dimension represents the Quad's vulnerability. ASEAN nations have been largely silent on the Quad's assertiveness.

## WESTERN RAILWAY TO EXTEND TRIPS OF 3 PAIRS OF SPECIAL TRAINS

SR.	TRAIN NO.	ORIGINATING STATION & DESTINATION	DATE OF SERVICES
1	09453	AHMEDABAD - SAMASTIPUR SPECIAL TRAIN	13.06.2021
	09454	SAMASTIPUR - AHMEDABAD SPECIAL TRAIN	16.06.2021
2	09501	OKHA - GUWAHATI SPECIAL TRAIN	18.06.2021
	09502	GUWAHATI - OKHA SPECIAL TRAIN	21.06.2021
3	09521	RAJKOT - SAMASTIPUR SPECIAL TRAIN	16.06.2021
	09522	SAMASTIPUR - RAJKOT SPECIAL TRAIN	19.06.2021

For detailed information regarding timings at halts, please visit [www.enquiry.indianrail.gov.in](http://www.enquiry.indianrail.gov.in)

Only passengers having confirmed tickets will be permitted to board these special trains. Passengers are advised to adhere all norms, SOPs related to COVID-19 during the boarding, travel and at destination.

The booking of Train Nos. 09453, 09501 & 09522 will open on 11.06.2021 at nominated PDS counters and on IRCTC website. Above trains will run as fully reserved Special Trains on Special Fare.



Please carry ID proof for all Reserved Tickets.

## SHRIRAM CITY UNION FINANCE LIMITED

Registered Office: Office No.123, Angappa Naicken Street, Chennai-600 001. Vapi Branch Office: No.32-34, 1st floor Sahara Market, Above ICICI bank Ltd. Vapi Silvassa Road Vapi-396191. Website: [www.shriramcity.in](http://www.shriramcity.in)

## DEMAND NOTICE

Whereas the borrowers/co-borrowers/guarantors/mentioned hereunder had availed the financial assistance from SHRIRAM CITY UNION FINANCE LIMITED. We state that despite having availed the financial assistance, the borrowers/guarantors have committed various defaults in repayment of interest and principal amounts as per due dates. The account has been classified as Non Performing Asset in accordance with the directives/guidelines issued by Reserve Bank of India, consequent to the Authorized Officer of SHRIRAM CITY UNION FINANCE LIMITED, under Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 & in exercise of powers conferred under Section 13(2) read with Rule 3 of Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices on respective dates mentioned herein below under Section 13(2) of SARFAESI Act, 2002 calling upon the following borrowers/guarantors/mortgagors to repay the amount mentioned in the notices together with further interest at the contractual rate on the amount mentioned in the notices and incidental expenses, cost, charges etc until the date of payment within 60 days from the date of receipt of notices. The notices issued to them on their last known addresses have returned un-served and as such they are hereby informed by way of public notice about the same.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Name of the Borrower (S) Co-Borrower(S)	Outstanding Amount	Loan Amount	Property Address of Secured Assets
Loan A/c No. CDPVITF1802280001	Rs. 72.85,644/-	Rs. 1,00,00,000	SCHEDULE OF PROPERTIES
Flat No 401, Shalin Apartment, Mullawadi, Valsad-396001	(Rupees) Seventy Two Lakh Eighty Five Thousand Six Hundred Forty Four Only)		All the piece and parcel of property being RA land bearing Survey Number 214/2/4(P1/2) measuring about 5000.00 sq.mtrs.situated at Daheli, Taluka Umbergaon, Dist Valsad with all right. North: Land Of Madhubhai South: Road and land East: Property Of Mohammad Ali West: School
3) Hema Malav Patel Blazom Co-op Housing Society, Ajit Nagar Chala, Vapi-396191			
4) Patel Malav Gajubhai Blazom Co-op Housing Society, Ajit Nagar Chala, Vapi-396191			
5) Swapnil Ashwinbhai Mistry Flat No 401, Shalin Apartment, Mullawadi, Valsad-396001			

In the circumstances as aforesaid, the notice is hereby given to the above borrowers, co-borrowers and/or their guarantors (where ever applicable) to pay the outstanding dues as mentioned above along with future interest and applicable charges within 60 days from the date of the publication of this notice failing which further steps will be taken after the expiry of 60 days of the date of this notice against the secured assets including taking possession of the secured assets of the borrowers and the mortgagors under Section 13(4) of Securitization and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and the applicable rules there under.

Please note that under Section 13(13) of the said Act, No Borrower shall, transfer by way of sale, lease or otherwise any of his secured assets referred to in the notice, without prior written consent of the secured creditor.

Place: Vapi Date: 11/06/2021 Sd/- Authorised Officer Shriram City Union Finance Ltd

## SANGINITA FINANCIALS LIMITED

(CIN: L24100GJ2005PLC047292)  
Registered Office: 301, 3rd Floor, Sankar Complex, Sector 11, Gandhinagar - 382 011 (Gujarat)  
Website: [www.sanginitafinancials.com.in](http://www.sanginitafinancials.com.in)  
Email-Id: [dbchavada@yahoo.com](mailto:dbchavada@yahoo.com)

## NOTICE FOR UPDATING EMAIL ADDRESSES, MOBILE NUMBER OF SHAREHOLDERS

Sanginita Financials Limited requests all its shareholders to register their email addresses and mobile number as per the procedure laid down hereunder. This will facilitate the Company for sending Annual Report, Notice of General Meeting and any other important communications through electronic mode in compliance with General Circular No. 14/2020 dated April 8, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No. 20/2020 dated May 5, 2020 and General Circular No. 02/2021-22 dated 13th January 2021 issued by the Ministry of Corporate Affairs, Govt. of India and SEBI vide Circular No. SEBI/HO/CFD/CMD/CI/CP/20/2019 dated May 12, 2020 and SEBI/HO/CFD/CMD/CI/CP/20/2021/11 January 15, 2021 in view of COVID-19. Shareholders holding shares of the Company in dematerialized form but who have not registered their email address and/or mobile number, are requested to approach their respective Depository through Depository Participant.

In view of aforesaid MCA & SEBI circulars, the Company is in the process of convening the 16th Annual General Meeting through Video Conferencing and Other Audio-Visual Means (VC & OAVM) without any physical presence of its members. The Annual Report including the Notice of the 16th AGM will be dispatched in due course to the members on their registered mail ID. Hence, it is highly recommended and Members are earnestly requested to get their mail ID registered with the Company. The Notice of the 16th AGM will contain detailed instructions for attending and participation in the 16th AGM as well as for casting of vote through Remote E-voting process or through E-voting during the 16th AGM. For any clarification, please contact Company's Registrar and Transfer Agent, M/s. Purna Sharecity (India) Private Limited at their Phone: 022-23016761, e-mail id [support@purnasharecity.com](mailto:support@purnasharecity.com).

DATE: 10/06/2021 FOR, SANGINITA FINANCIALS LIMITED

Place: GANDHINAGAR DINESHINBH B. CHAVADA(DIN No. 01497977) CHAIRPERSON & MANAGING DIRECTOR

Printed & Published by Mayur C. Bhatt on behalf of Kalyani Pub. Pvt. Ltd. Printed at: Mahadev Offset, H-7 Ravi Estate, Rustam Mill Compound, Dushdevwar, Ahmedabad-4. Published from: 201-2, Nandan Com. Opp. Mitakhalai Rly Crossing, Mitakhalai, Ahd-6. Ed.: Mayur Bhatt

## PRAVEG COMMUNICATIONS (INDIA) LIMITED

(Formerly Sword and Shield Pharma Limited in which Praveg Communications Limited has amalgamated)  
PRAVEG Regd. Office: 214, Athena Avenue, Behind Jaguar Showroom, S.G. Highway, Gota, Ahmedabad - 382481  
Phone: +91 79 24967137 | Website: [www.praveg.com](http://www.praveg.com) | E-mail: [cs@praveg.com](mailto:cs@praveg.com)

## Extract of Audited Consolidated Financial Results for the Quarter and Year ended March 31, 2021

Particulars	Quarter ended 31/03/2021	Quarter ended 31/03/2020	Year ended 31/03/2021	Year ended 31/03/2020
Revenue from Operations	2196.36	2293.40	4531.52	5956.15
Profit before exceptional items and tax	682.33	633.21	1426.44	522.67
Profit for the period	519.05	479.84	1074.06	380.02
Total Comprehensive Income (after tax)	523.04	479.84	1078.05	380.02
Paid up Equity Share Capital (of Rs. 10 each)	1848.41	1848.41	1848.41	1848.41
Other Equity excluding revaluation reserve*			57.33	-373.59
Earnings per equity share (of Rs. 10 each)				
Basic and Diluted (Not Annualised)	2.83	2.60	5.83	2.06

Notes: 1. The Audit Committee has reviewed the above results and the Board of Directors has approved the above results at their respective meetings held on June 10, 2021.

2. Additional information on Audited Standalone Financial Results is as follows:

Particulars	Quarter ended 31/03/2021	Quarter ended 31/03/2020	Year ended 31/03/2021	Year ended 31/03/2020
Revenue from Operations	2196.39	2293.40	4527.05	5956.80
Profit before exceptional items and tax	683.14	633.24	1432.27	520.31
Profit for the period	519.91	480.92	1079.89	377.87
Total Comprehensive Income (after tax)	523.90	480.92	1083.88	377.87
Paid up Equity Share Capital (of Rs. 10 each)	1848.41	1848.41	1848.41	1848.41
Other Equity excluding revaluation reserve*			67.43	-369.51
Earnings per equity share (of Rs. 10 each)				
Basic and Diluted (Not Annualised)	2.83	2.60	5.86	2.04

3. The above is an extract of the detailed form of the standalone and consolidated financial results for the quarter and year ended on March 31, 2021, filed with the Stock Exchanges pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

4. The full form of the standalone and consolidated financial results for the quarter and year ended on March 31, 2021, are available on the Stock Exchange's website ([www.bseindia.com](http://www.bseindia.com)) and the Company's website [www.praveg.com](http://www.praveg.com).

## For Praveg Communications (India) Limited

(Formerly known as Sword and Shield Pharma Limited)

Place: Ahmedabad Date: June 10, 2021 Vishnukumar Patel Chairman



## સંપાદકીય થર્ક વેવના ભણકારા

કોરોનાની બીજા લહેરની તીવ્રતા ઓસરતી જોવા મળે છે. કોરોનાના કેસોપદવા લાગ્યા છે, કોવિડ સેન્ટરો બંધ થઈ રહ્યા છે, હોસ્પિટલના કોવિડ નોર્ડ સમૂહો ખાલી દેખાય છે, ઓક્સિજનની અછત વતારી નથી રહી અને દવાના ક્ષણભજર થઈ રહ્યા નથી. જનજીવન તેની પૂર્વવત ગતિમાં, જે પરિવારોએ કોરોનાની બીજા થાક લહેરમાં સ્વજનો ગુમાવ્યા તેનું દુઃખ તો છે જ પણ હવે એક પરપત પછ છે કે એપ્રિલ-મે જેવો કપરો કાળ હવે નહીં જોવો પડે. કેસ ભલે થઈ ગયાઓ અને નાઈટ ફરફરમાં પણ થીમે થીમે છૂટ આપવામાં આવી રહી હોય તો પણ કોરોનાની તીજ લહેરનો અરશ્વ ૨૨ શહેરોમાં વ્યાપેલો દેખાય છે. ખાસ કરીને નાના ભાજીઓ માતાપિતા કોરોનાની સંભવિત તીજ લહેરથી અલગીત છે. બધાના મનમાં એક સવાલ છે કે શું કોરોનાનો થર્ક વેવ આવશે? જો આવશે તો એના શિકાર કોણ બનશે? એ સંકેત વેવ કરતા વધુ પ્રાથમિક સંભિત થશે?

ભારતની પ્રજાએ બહારથી કોરોનાની મહામારીનો સામનો કર્યો છે. ભારત સરકાર દ્વારામાં પ્રથમ સરકાર હતી જેણે દેશવ્યાપી સફર લોકડાઉનનો નિર્ણય લીધો હતો. ભારતની પ્રજા પણ દુનિયાના બધા દેશોમાં એકાદમ એવી પ્રજા હતી જેણે લોકડાઉનની સીકવ્યું હતું અને પોતાની તથા સમાજની સુરક્ષા માટે થમાં જ રહેવાનું મુનાસિબ માન્યું હતું. પરંતુ જેમ જેમ લોકડાઉનના એક પછી એક ચરણ આગતા ગયા, બીજા અને ત્રીજા લોકડાઉનની જાહેરાત થઈ એમ એમ લોકોના કષ્ટાગ ઉપર કરચલીઓ નવવા લાગી.

થરમાં જ પડ્યા રહેવાનો રોમાંચ ખતમ થઈ ગયેલો અને નોકરી-પંધાની ચિંતા વધવા લાગી હતી. તો પણ ગયા નથી દિવાળી સુધીમાં કોરોના કટોકટીમાં હતો. ભારતની સ્થિતિ અમેરિકા કરતા વધુ ખરાબ ન હતી. દિવાળી પછી સ્થિતિ વધારવાની શરૂ થઈ અને આ વર્ષના ફેબ્રુઆરીથી કોરોનાના નવા મુદતો રજાએ હાલકાર મચાવી દીધો. સેન્ટર સરકારે નોકરીઓને અથવા તો ખાતાઓનો મોગોવની પસાર થઈ ગયા હતા એ સવાલ ઊભો રહે છે કે કોરોનાનો થર્ક વેવ આવશે કે નહીં? દુનિયાના ઘણા નિષ્ણાતો, રોગચાળા જવા વિષય ઉપર પીએચ.ડી કરનારા સ્કોલરો, ડોક્ટરો અને વિશ્વ આરોગ્ય સંસ્થાના અમુક સભ્યોનું કહેવું છે કે ભારતમાં કોરોનાની તીજ લહેર આવવાની પૂરી શક્યતા છે અને જો એ આવશે તો તે ખૂબ હાનિકારક સાબિત થશે.

આ જાણીરેવાનું નથી પરંતુ આગલા વાઙ્કમાં રહેલા શબ્દ 'જો' ને ભાવ્યુંએ ક્યાંવારનો છે. જો કોરોનાનો થર્ક વેવ આવશે તો, આ જો અને તો ની રમત છે એનો અર્થ એ પણ થાય છે કે કોરોનાનો તીજ વેવ આવશે કે નહીં તો ?

એક શક્યતા એવિચારવામાં આવી રહી છે કે કોરોનાનો તીજ વેવ કદાચ નહીં આવે. થર્ક વેવની નહિવત સંભાવના પાછળ અમુક નક્કર કારણો પણ રહેલા છે. ભારત સરકારે બહુ જ હલખણમાં નિર્ણય લીધો અને વેક્સિનની નિકાસ કરવાનું બંધ કર્યું. માર્ચ મહિનામાં એક લોકો એવો હતો કે ભારતીયોએ જોવા વેક્સિનના ઝોડ મળ્યા હતા એનાથી વધુ ઝોડની બીજા દેશોમાં નિકાસ થઈ હતી.

હવે વેક્સિન માટે ભારતીયોને જ અગ્રીમતા આપવામાં આવે છે માટે ભારતમાં બનતી વેક્સિનફક્ત ભારતીયોને મળે છે. માટે વેક્સિનેશનની ઝડપ વધી છે. વધુમાં વડાપ્રધાને એ દમ્મણ જ જાહેર કર્યું કે એકવીસ જુનથી ૧૮થી પિસતાવીસ વર્ષના યુવાનોને વેક્સિન વિનામુલ્યે મળશે. જો કે અત્યાર સુધી વડીલો અને યુવાનો વેક્સિન વિનામુલ્યે જ મળી છે.

સાથે સાથે ધારૂદેવે વેક્સિટોને પણ અમુક ચોક્કસ રકમ લઈને વેક્સિન આપવાની છૂટ આપવામાં આવી છે. ગુજરાતમાં જ લાખો લોકોને વેક્સિનના મને ઝોડ મળી ગયા છે. બે ઝોડ લઈ લીધા હોય એવુંજાણતીઓની સંખ્યા ટૂંક સમયમાં કરોડમાં ગણાતી હશે. થથી પછી હામાં કંપનીઓ પણ વેક્સિન બનાવવામાં લાગી છે. વન ઝોડ વેક્સિન પણ આવી રહી છે અને નવી દવાઓ આગાતા નેઝલ વેક્સિન પણ આવશે. અમુક હામાં કંપનીઓએ કોરોનાની અસર ઘટાડે એવી દવાઓને માર્કેટમાં મુકવાની પણ બાહોશી આપી છે. જેરોજે વેક્સિન લેવાના લોકોની સંખ્યામાં ઘટાડો, કોરોનાના કેસમાં ઘટાડો, તંત્રની વખતી જતી સુસજ્જતા અને નવી દવાઓ તથા નવી વેક્સિનનું આપવાકોરોનાના થર્ક વેવને રોકશે એવું લાગે છે. પણ જો અને તો નો સિલ્કાત અહીં પણ લાગુ પડે છે. કોરોનાનો રોગવા માટે માસ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ તો આવશ્યક જ નહીં પણ અનિવાર્ય રહેશે. જો કબલતમાં રહ્યા તો થથી હાણી ભોગવવાની થાય પણ ખરી. જનજીવન તેની પૂર્વવત ગતિમાં ગોઠવાઈ રહ્યું છે એ જનમાનસમાંથી ફફડાટ ઓછો થઈ ગયો છે. અલબત્ત, જે પરિવારોએ કોરોનાની બીજા થાક લહેરમાં સ્વજનો ગુમાવ્યા તેનું દુઃખ તો છે જ પણ હવે એક પરપત પછ છે કે એપ્રિલ-મે જેવો કપરો કાળ હવે નહીં જોવો પડે.

## શ્રી શ્રીદ્વિનાયક દેવસ્થાન, મહેમદાવાદ ભક્તો માટે ખોલવામાં આવશે



મહેમદાવાદ ભક્તો માટે ખોલવામાં આવશે, તદ્દપરોત ગાઉડાલોનું મુજબ દર્શન માટે માસ્ક ફરજિયાત પહેરશે જ આવવાનું રહેશે. મંદિરમાં અને આખા સંકુલમાં સામાજિક અંતર જાળવવાનું રહેશે, ટેમ્પલર ચેક કરાવી, હાથ સેન્ટાઇઝ કરીને જ રોજવાની દેવસ્થાન, પ્રવેશ કરવાનો રહેશે.

## મોદીનો કફર વિરોધી શિવરાજનો ઓએસડી

નવીદિલ્લી મોદી સામે ભૂતકાળમાં ખરાબ કોર્પોરેશન કરનારા તુષાર પંચાલને ઓએસડી બનાવીને શિવરાજસિંહ ચૌહાણ મોટા વિવાદમાં ફસાઈ ગયા. ભાજપના નેતા અને સમર્થકોએ તુષાર પંચાલ સાથે કે, શિવરાજસિંહ, તપને આવા માણસનજર છે ? શિવરાજ પોતાનું સોશિયલ મીડિયા સંભળતા પંચાલને સોમવારે સુપ્રમંચની ઓફિસમાં ઓએસડી નિમ્મા હતા.

પંચાલની મોટી વિરોધી ઘણી જૂની છેપર વાવપર ઘતાં કસાવેલા શિવરાજ પોતે તુષારને આ હોહો નહીં રવકારવાની જાહેરાત કરાડાવવી પડી. નિમજુકેના બે દિવસમાં તો પંચાલે ધરબેલા થવું પડ્યું છાપો મોટી સમર્થકો તેમના ગણો આપી રહ્યા છે.

તુષારે ભૂતકાળમાં લખ્યું હતું કે, કિસ્મતે તો મોઝેસી હો. સવાલ પૂછ્યું કે કિયે ઓફિસ મં વિષય કા નેતા નહીં ઓર ઘર પર બીવી નહી. એક વાર તેણે લખેલું કે, મીડિયા મોડીનું યુજરતા શબ્દો વાપરે છે તેની સામે મને સખત વાંધો છે. મોટી ગુજરાતના છે, ગુજરાત મોટીનુંનથી પંચાલે ગોમનું એક ગંદી પ્રેમેન્ટ કરી હતી તે પણ વાવરલ થઈ છે.

પંચાલે-સિધુનો નામ થાયાંને જો ભાજપ જિતિત

જિતિત પ્રસાદ કોઝેસ છોડીને ભાજપમાં એક ઘટનામાં કોઝેસ જ નહી, મીડિયા પણ ઉઘેતું ઝાડ્યું છે. જિતિત પ્રસાદ ભાજપમાં જોડશે એવી કોઝેસ કલ્પના પણ નહોતી.

ભાજપ સાંસદ અને પ્રવક્તા અનિલ બજવાનીએ સવારે ટ્વિટ કર્યું હતું કે, આજે એક મોટી ઇસ્તી ભાજપ પ્રમુખ નંદાની હાજરીમાં ભાજપમાં જોડાઈ જશે. આવિટના કારણે આ મોટી ઇસ્તી કોણ હશે તે અંગે અટકળો શરૂ થઈ હતી.

પંચાલને કેપ્ટન સામે લડી રહેલા નવખેત સિધુથી મોડીને રાજધાનમાં ગેલોલતી હાઈકમાન્ડ દ્વારા ખુલ્લી તકદારીથી નારાજ સચિન પાયલોટ સહિતનાં નામખતો થઈ ગયાં હતાં પણ જિતિતનું નામ કોઈની જાને નહોતું આવ્યું. જિતિત બંગાળમાં કોઝેસના પ્રમાણી હતા. કોઝેસની કારની ઘરના પગલે રાજકીય મોટી જિતિતની ક્રાંતિ થવા પડી હતી.

જિતિતની ક્રાંતિ થવા પડી હતી તેથી તેનું નામ જ ક્યાંપ નહોતુંજાણતું. જિતિને બંગાળ ભાજપ પ્રમુખ દિલીપ ધોપના માધ્યમથી ભાજપમાં આવવાનો ત્રાસ ગોઠવ્યો હોવાની ચર્ચા થાઈ રહી આવી છે. બંગાળમાં પરિમાન પહેલાં આ તમ્મો ગોઠવાઈ ગયો હતો પણ યોગ્ય સમયની રીત જોવાતી હતી.

જિતિતને પ્રસાદ કોઝેસ કાર્ડ કર્યું ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં કોઝેસ છોડીને જિતિત પ્રસાદ ભાજપમાં જોડાઈ જતાં કોઝેસને બહુ મોટો ફટકો પડ્યો છે. યુધીમાં સવચ્છોને પોતાની તરફ ખેંચીને લેશે.

બેઠી ધવાની-રિયંકા ગાંધીની વ્યૂહરત્ન સુવર્ણની વિદાયરત્ન મોટો ફટકો પડ્યો છે. એક સમયે જિતિતની ગણના સુધીના રાજકીય નેતાઓમાં થતી હતી પણ સળંગ બે લોકસભા ચૂંટણીમાં હાર પામીને જિતિતની રાજકીય કારકિર્દી પતી ગયેલી મનાતી હતી. જિતિને પ્રસાદ કોઝેસ કાર્ડ કરીને બે વર્ષ પહેલાં 'બ્રાહ્મણ ચેતના પરિષદ'ની રચના કરીને ફરી પોતાની રાજકીય તાકાત ઊભી કરી છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે. બ્રાહ્મણ યુવા-યુવતીઓ મોટી સંખ્યામાં સંગઠનમાં જોડાઈ રહ્યાં છે. યુધીના વસતીમાં ૧૨ ટકા બ્રાહ્મણો છે. પરંપરાગત રીતે આ મતભેદ ભાજપની જોડે પણ વિકાસ દુબેના સંગઠનમાં જોડાઈ રહ્યાં છે. યુધીના વસતીમાં ૧૨ ટકા બ્રાહ્મણો છે. પરંપરાગત રીતે આ મતભેદ ભાજપની જોડે પણ વિકાસ દુબેના સંગઠનમાં જોડાઈ રહ્યાં છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વચ્ચદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષો આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે.

## અરવલ્લીમાં ૧૧ હજાર મેટ્રિક ટન ઘઉંની ખરીદી

મોડાસ, ગુજરાત રાજ્ય પુરવઠા નિમમ્બા, દ્વારા ચાલુ વર્ષે કરાવેલા પ્રતિમણ ૩.૩૮૫૮૧૧ ટકાના ભાવે થઈ ખરીદીની પ્રક્રિયા અને રેફરેન્સ ના હાથ પડ્યાં હતું. અરવલ્લી જિલ્લામાં ૮ કેન્દ્રો શરૂ કરાયા હતા અને ૮૫માર્ચથી ૩૧મી માર્ચ ૨૦૨૧ દરમિયાન રેફરેન્સ કરાવાતા જિલ્લામાંથી ૬૯૫૫ મેટ્રિક ટન પોતાના ઘઉં ટકાના ભાવે વેચવા રેફરેન્સ કરાવ્યું હતું અને ૧૬મી માર્ચથી ખરીદી પણ શરૂ કરાઈ હતી. પરંતુ જિલ્લામાં કોરોનાના કસો વખતે નિમમ્બા મેટ્રિકના વિચાર હિતમાં ખરીદી બંધ કરાવી હતી. સમગ્ર રાજ્યમાં અરવલ્લી જિલ્લા પુરવઠા તંત્રએ ટકાના ભાવે ૧૧ હજાર મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવાની સાથે ૨૧.૭૭ કરોડ રૂપિયાની મેટ્રિક ટન ચુકવણી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ૩૦ મી જૂન સુધી ટકાના ભાવે ઘઉં ખરીદી કરશે અંદાજે ૩૦ દિવસ બંધ રહ્યા પછી ૨૪મી જિલ્લાના ૮ કેન્દ્રો ટકાના ભાવે પ્રતિમણ ૩.૩૮૫૮૧૧ ભાવે ઘઉંની ખરીદી શરૂ કરાઈ છે. જિલ્લાપુરવઠા તંત્ર તા. ૮/

૩/૨૧થી ૩૧/૩/૨૧ દરમિયાન છે. રાજ્ય સરકારે ટકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરી છે, જેને લઈને અરવલ્લી જિલ્લાના આઠ કેન્દ્રો પર સુધી ટકાના ભાવે ઘઉં ખરીદી કરવાનું આવી રહ્યું છે.

### MERCURY METALS LIMITED

CIN:L27109GJ1986PLC008770  
36, Advani Market O/S Delhi Municipal Market  
Ahmedabad-380004  
Contact Details: +91 79 26442231  
Email: metal.mercury@gmail.com  
Website: www.mercurymetals.in

### NOTICE

Notice is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a meeting of the Board of Directors (202nd/2021-22) of the Company will be held on Monday, 21st June 2021 at the Registered Office of the Company to consider and approve inter alia, Audited Financial Results of the Company for the year ended on 31st March, 2021 and to transact the other businesses mentioned in the Board Meeting Notice.

The said Notice is also available on the website of the Company at www.mercurymetals.in and on the website of Stock Exchange where shares of the Company are listed i.e. www.bseindia.com

By Order of the Board

Sd/-  
Govindram L. Kabra  
Whole time Director  
(DIN: 00006621)

Place: Ahmedabad  
Date: 10/06/2021

### PRAVEG COMMUNICATIONS (INDIA) LIMITED

(Formerly Sword and Shield Pharma Limited in which Praveg Communications Limited has amalgamated)

CIN: L24231GJ1995PLC024809  
Praveg Regd. Office: 214, Athena Avenue, Behind Jaguar Showroom, S.G. Highway, Gota, Ahmedabad - 382481  
Phone: +91 79 27496737 | Website: www.praveg.com | E-mail: cs@praveg.com

"Extract of Audited Consolidated Financial Results" for the Quarter and Year ended March 31, 2021"

(Rs. in Lakhs, except per share data)

Particulars	Quarter ended 31/03/2021	Quarter ended 31/03/2020	Year ended 31/03/2021	Year ended 31/03/2020
Revenue from Operations	2196.39	2293.40	4531.52	5956.15
Profit before exceptional items and tax	683.14	633.24	1432.27	520.31
Profit before tax	683.14	633.24	1432.27	520.31
Profit for the period	519.91	479.84	1078.89	377.87
Total Comprehensive Income (after tax)	519.91	479.84	1078.89	377.87
Other Equity excluding revaluation reserve*	1848.41	1848.41	1848.41	1848.41
Earnings per equity share (of Rs. 10 each)	2.83	2.60	5.86	2.04
Basic and Diluted (Not Annualised)	2.83	2.60	5.86	2.04

Notes:

1 The Audit Committee has reviewed the above results and the Board of Directors has approved the above results at their respective meetings held on June 10, 2021

2 Additional information on Audited Standalone Financial Results is as follows:

Particulars	Quarter ended 31/03/2021	Quarter ended 31/03/2020	Year ended 31/03/2021	Year ended 31/03/2020
Revenue from Operations	2196.39	2293.40	4531.52	5956.15
Profit before exceptional items and tax	683.14	633.24	1432.27	520.31
Profit before tax	683.14	633.24	1432.27	520.31
Profit for the period	519.91	479.84	1078.89	377.87
Total Comprehensive Income (after tax)	519.91	479.84	1078.89	377.87
Other Equity excluding revaluation reserve*	1848.41	1848.41	1848.41	1848.41
Earnings per equity share (of Rs. 10 each)	2.83	2.60	5.86	2.04
Basic and Diluted (Not Annualised)	2.83	2.60	5.86	2.04

3 The above is an extract of the detailed format of the standalone and consolidated financial results for the quarter and year ended on March 31, 2021 filed with the Stock Exchanges pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

4 The full format of the standalone and consolidated financial results for the quarter and year ended on March 31, 2021 are available on the Stock Exchange's website (www.bseindia.com) and the Company's website www.praveg.com.

For Praveg Communications (India) Limited

(Formerly known as Sword and Shield Pharma Limited)

Sd/-  
Vishnukumar Patel  
Chairman

Place: Ahmedabad  
Date: June 10, 2021

SHIRIRAM City  
MONEY WHEN YOU NEED IT MOST